

# ગુજરાત જાહેર સેવા આયોગ

(ખાંખી રંગનું સ્ટીકર અહીં ચોટાડવું)

Main Answer Book  
મુખ્ય જવાબદિ

108124180 : ROLL NO  
2 : BLOCK  
101000971 : TICKET NO  
900971 : ANS NO  
Subject : GEN. STUD

29/05/2016 10:00 AM



GPSC - 2016

टિકટ નંબર Ticket Number	1	0	1	0	0	0	9	7
રોલ નંબર Roll Number	1	0	8	1	2	4	1	8
ઉમેદવારનું Name	HIRENDRA JASHUBHAI							
નામ Name	CHAUDHARI							
નિરીક્ષકનાનામ Name of Examiner	R.D. DAIY							

પરીક્ષાનું નામ : APE DIS CNF AA-3 DEPUTY  
SECTION OFFICER DEPUTY  
MAMLATDAR CLASS III  
વિષય : General Studies (Paper-III)

પરીક્ષાની તરીખ : 29/05/2016

પ્રશ્ન ક્રમાંક	પેટા પ્રશ્ન ક્રમાંક	કુલ ગુણ	મેળવેલ ગુણ	રિમાઇર્સ
પ્ર. 1	(અ)	09	6	
	(બ)	04	4	
	(ક)	03	3	
પ્ર. 2	(અ)	06	4	
	(બ)	04	3	
	(ક)	04	3	
પ્ર. 3	(અ)	10	10	
	(બ)	04	4	
	(ક)	03		
પ્ર. 4	(અ)	10	10	
	(બ)	04	4	
	(ક)	01		
પ્ર. 5	(અ)	06	06	5½
	(બ)	08	06	5½
	(ક)	01	0	
પ્ર. 6	(અ)	09	04	
	(બ)	04	01	
	(ક)	01	0	
પ્ર. 7		14	9	

મેળવેલ કુલ ગુણ અંકડામાં તથા શબ્દોમાં  
66 - Sixty Six only  
Sixty Seven and

ઉમેદવારે આ જગ્યામાં કુર્ચી લખવું નહીં	GPSC-2016	
		21264
		GPSC-2016

અહીંથી ઉત્તરો લખવાનું શરૂ કરો.

(અ) દરેક પેટા અક્ષનાં 3 ગુણ છે. અને દરેક ઉત્તર આશરે 50 થબ્દમાં આપવાનો રહેશે.

(1) સ્વાતંત્ર્ય સંગ્રહમાં "ખેડા સત્યાગ્રહ" નું મહત્વ જણાવો.

જવાબ : " ખેડા સત્યાગ્રહ " મધ્યામા ગાંધીજી દ્વારા 1918

માં અંગ્રોર અદ્ધકાર વિરુદ્ધ પ્રલાવવામાં

આવ્યું હતું . આ સત્યાગ્રહની હૃતું

અદ્ધકાર દ્વારા અતિવૃદ્ધી ધ્યાં છતાં દ્વિદરાવવામાં

આપતા 62 વિન્દુ વિરુદ્ધ હતી.

મેળવેલ :

ગુણ

6

કુલગુણ : 09

2

o એ સત્યાગ્રહ દ્વારા

- ગાંધીજીએ પ્રથમવાર અદ્ધકાર વિરુદ્ધ

"ના કર" નું અભિયાન પ્રલાવ્યું.

- સરદાર પટેલ જીવાં લોતા મણ્યા.

- કાવિનય કાનું અધ્યાત્માની સ્ફુર મૃથાગ.

- માર્ગાઓનો ક્રિયા.

- નાના પિલાનો સંદેશા.

- ગાંધીજીનાં વિચારોની રસીકૃતિ.

(2) ગુજરાતનાં ઇતિહાસમાં સુવર્ણકાળ ગણાતા "સોલંકીકાળ" વિષે જણાવો.

જવાબ : ० ગુજરાતાના સોલંકીકાળના અમદાય ઉત્તમ ૪૫૨ થી ૧૨૪૪ સુધીનો હતો.

• આ સમાચારો ગુજરાતને પોતાની આગામ મળી.

० "ગુજરાત" ૧૦૬૯ના પ્રથમવાં ઉલ્લંઘા.

० સાહિત્ય, ધર્મ, રચાપત્ર્ય, કલા વર્ષોને તુંને ઉત્તમ વિકાસ સધ્યાદો.

० ગુજરાતને પીમદેવ, સિદ્ધદરાજ જયસીંહ, કર્ણાદેવ નેઓના મુજબાત્સાહ્ય શાસકો મળ્યાં.

० બધાં ધર્મને પ્રોત્સાહન તથા એ અસ્તિત્વનું વાતાવરણ મળ્યું. જેણ ધર્મનો સારો વિકાર થયો.

(3) ગુજરાતી સાહિત્યમાં કવિ સુરસિંહજી તપાસિંહજી ગોદીલ નું યોગદાન જણાવો.

જવાબ : ० સુરસિંહજી તપાસિંહજી ગોદીલ "કલાપી" ના ઉપનામથી ડાયિગ્રામી પ્રમાણે હતો.

• ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ ઉત્કૃષ્ટાત્મક પ્રાર્થા.

• અપાચ્યિત ગુજરાતી કવિતામાં પ્રાર્થા  
અને મફુતાતો ઉત્તમ કાવ્યો જણાયાં  
અને સમાન લુચી કવિતામાં નવા  
સીમાયિદુનો ખડા હથ્યા.

• "કલાપીની ક્રેઝરાવ" એમણી કવિતાઓને શોષ્ટ સંભૂદ છે.

દરેક પેટા પ્રક્રિયાનાં 2 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 35 શબ્દોમાં આપવાના રહેશે.

(1) મોગળ શહેનશાહોનાં વખતમાં ભારતમાં બાંધવામાં આવેલ સ્થાપત્યો વિષે જણાવો.

દસ્તાવેજ : મારોણામ કાળ સમયમાં વ્યુઝ્બિતમાં અને બાંધવામાં આવેલ અધ્યાત્માનાં કૃચાપત્યોનાં મુખ્ય

મેળવેલ :  
ગુણ  
ચ

કુલગુણ : 04

- શાહિયાગ અનુભે જો જણાએનીર ફ્રારા બનાવાયા.
- સુસ્તનમાં મુગાલ સરાઈ જ્યાં યાકાબુદ્દો માટે એહેવાની કાગવડ હતી.
- અકબર ફ્રારા આગ્રામાં મંદિર, હુમાયુનો માનુષ.
- શાહજહાન ફ્રારા તાજમહાલ
- અંગેઝેલ ફ્રારા લાલ કિલ્સી દિલ્હીમાં

2

(2) ગુજરાતી સાહિત્યમાં ડનેયાલાલ મુનશીનું મહત્વનું પ્રદાન જણાવો.

દસ્તાવેજ : • કેન્દ્રાસાં મુજશી અનેસે ઉત્તેમ નવસંક્ષયાકાર.

- અંતિદુસ્તિક નવસંક્ષયાઓ સોથી પણ લોડપ્રિય.
- મુખ્યમાં વિદ્યાબ્યવનની સ્થાપના.
- નાન્દી, અંકાંડી, નવસંક્ષયા, વિવિધન, આભસ્થા, કુલ્લાંદી, વગોરેનાં બહુઆયભીષણ સર્જન છુંબું.
- "પારણની પ્રયુતા", "દુષ્ટસાતના નાથ", વગોરેની અંતિદુસ્તિક નવસંક્ષયાઓ આપી છે.
- "વાહ રે મે વાહ" જોવા નાન્દી, "સાધની શોધમા" જોવી અભાલસ્થયાઓ પણ આપી છે.

2

= દરેક પેટા પ્રક્રિયાનો 1 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 10-20 શબ્દોમાં આપવાનો રહેશે.

(1) ગુજરાતી સાહિત્યનાં વિકાસમાં લોકસાહિત્યને ઘણો જ મહત્વનો ભાગ અજ્ઞવેલ છે.

દસ્તાવેજ : લોકસાહિત્ય ફ્રારા પોરાણિક વરતિયો, દુહિયો, શીર્થ હયાઓ, પ્રત કથાઓ, અને લોક પણ પણ પરંપરાને જો કેઢોપક્કણ સાધવામાં આપ્યું છે હું તેને લેખિત ક્વર્ટ્યુપ આપીને સાધવાનો અનિ કુલ્લાંદાન કાળો આથ્યો છે.

મેળવેલ :  
ગુણ  
3

કુલગુણ : 03

2) સયાજીરાવ ગાયકવાડ નું શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં યોગદાન જણાવો.

દસ્તાવેજ : સયાજીરાવ ગાયકવાડ ફ્રારા

- પ્રાથમિક શિક્ષણ ફરજાનાત જ્ઞાનવામાં આપ્યું.
- શાળાઓ, કલ્યાણ શિક્ષણ, વગોરેની પ્રોલ્યાનિ
- કલા, સાહિત્ય અને ઉદ્યોગો માટે પણ પ્રયત્નો કર્યો. કલાબ્યવનની વધારણા.

1

(3) રાજમાતા મીનળટેવીનું ગુજરાતના જણસંચય ક્ષેત્રે ધોગદાન જણાવો.

જવાબ :

- માનિલાદેવી પ્રાર્થના ગુજરાતમાં જણસંચયના વારાણ્સી અને તળાવો પ્રદાનવામાં હોય,
- ધોગઢામાં, વિશ્વમાનમાં તળાવો પ્રદાનથા,

અ) દરેક પેટો પ્રક્રિયાનાં 3 ગુણ છે. અને દરેક ઉત્તર આથરે 50 શરૂઆતમાં આપવાના રહેશે.

(1) માનવીય સંસદ સભ્યોશ્રીઓનાં સંસદીય વિશેખાધિકારો ક્યા છે?

જવાબ : સૌસ્પિદ ભાગ્યોક્રીયાઓનાં સંસદીય વિશેખાધિકારો  
ન્યુઝેનનાં બંધારણમાણી લેવાથા હો.

મેળવેલ :  
ગુણ  
4  
કુલગુણ : 06

- સૌસ્પિદનાં જીત્રા દરમિયાન અને સત્ત્ર વાલુ થયાનાં પૂછા  
અને જીત્રા પુફ થયાનાં ફરીં 50 દિવસોમાં ડોઇપિલ  
સૌસ્પિદ સાચયની ઘરપકડ હોણી શકાય નાહિએ.
- સૌસ્પિદમાં જોલાથસાં ડોઇપિલ પ્રાથમિક પ્રક્રિયા  
ન્યાયિક હાર્થેવાણી હરી હણાય નાહિએ.
- હોન્ડાણી શુણા સંબંધમાં 14 દિવસની નોંધે  
આપ્યા સ્વિબાય હાર્થેવાણી હરી શકાય બાણી.

2

(2) "વાયપ્રદી ગુજરાત" ને કારણે, ગુજરાતમાં એક નવો ઔદ્યોગિક પુગ શરૂ થયેલ છે.

ચર્ચા કરો.

જવાબ : "વાયપ્રદી ગુજરાત" રૂપજીવાત કરણીં 2 ફેસ અને

ગુજરાતમાં રોલા - રોલાનીની ડેફેન્શિન  
રોલાને આઠથવા માર્ગે વલાવાતો કાર્યક્રમ છે.

"વાયપ્રદી રૂપજીવાત" ના કારણો :

- ગુજરાતમાં વિદેશી હંપનીયો રોલા હોય છે.
- અધ્યુક્તિ ઉત્પાદનની રેકોર્ડોનું હાજે છે.
- નવા રોજગારનું સ્થાપન હોય છે.
- સ્પર્ધાત્મકતાનાં વિકાસને કારણો બને છે.
- ગુજરાતનાં સ્માધનો તથા વસ્તુઓ મળે છે.
- ગુજરાતમાં અધ્યક્તિ મધ્યતિઝોનો વેગ  
મળે છે.

આમ, એક નવા અધ્યુક્તિ ચુંગાની રાસ્ત્રાંત થઈ છે

2

-2.	b) દરેક પેટા પ્રક્રનાં 2 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 35 શબ્દોમાં આપવાના રહેશે.	(1) સેબી "SEBI" નાં કાર્યક્રમ વિષે જણાવો.	મેળવેલ : ગુણ કુલગુણ : 04
			જવાબ : <ul style="list-style-type: none"><li>o <u>SEBI - Securities and Exchange Board of India.</u></li><li>o મુખ્યભાગનું માર્ગદર્શિકા નિયમન હૈનું નિયમાંથી ડર્ટ્સ.</li><li>o મુખ્યભાગમાં "ઇન્વેસ્ટર્સ ટ્રેડિંગ". ઠેવી પ્રવૃત્તિઓ પર રોક લગાવવી.</li><li>o શૈરખભાગમાં રોડાલાયનો <u>ફિનેન્ચિયલ ક્રુઝ</u>.</li><li>o નિયમાંથી ક્રેનાર વ્યાખ્યાને કાયદેસર કાયદીબાટી કરવી.</li></ul>
-2.	(2) બિન આયોજન ખર્ચ (Non-plan expenditure) વિષે જણાવો.	જવાબ : અનુભૂત ફ્રાશ કરવામાં હોયતાં આવર્થક હૈનું <ul style="list-style-type: none"><li>- ઠેનું, પહેલાંથી નિયોજન ન કરી રહ્યાય હોવો અર્થી.</li><li>- સેરકારી કર્મચારીઓનાં પગાર રહેને પેંટાન.</li><li>- દાખલ પર કરવામાં હોવતો અર્થ.</li><li>- કાબસીનિંબાં દુપ્લમાં અર્થ.</li><li>- વિદેશી પ્રકાર પર જૂઓવાનું ત્યાખ.</li></ul>	2
-2.	c) દરેક પેટા પ્રક્રનો 1 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 10-20 શબ્દોમાં આપવાનો રહેશે.	(1) "હેબિસ કોર્પસ" "Habeas' Corpus" શું છે?	મેળવેલ : ગુણ કુલગુણ : -
			જવાબ : બંધી પ્રત્યક્ષિકરણ અને ઉચ્ચ વ્યાયાલય તથા કરી અદાલતનાં વ્યાપવાળાં અપાલદ આદિશાપત્રીય અધિકાર હૈ. ગાંધીજાયદેસર રીતે અદ્યકાયત કરેલો કાન્ટિને મુક્ત કરી કોઈમાં રજૂ કરવાનો આદિશ.
	(2) ભારતની "શેત કાન્ટિ" (White revolution) પર ટુંકનોંધ લખો.	જવાબ : <ul style="list-style-type: none"><li>o દેશમાં દૂધનાં ઉત્પાદનમાં વધારો કરી કાપીએ અર્થાયારથાને મજબૂત કરવાનો આનન્દી કાન્ટિ.</li><li>o ડૉ. વર્ગીસ ક્રુદ્ધિયન દ્વારા.</li><li>o દૂધાનાં પશુઓનાં સંચયામાં વધારો કરવો, ઉત્તમ કોઈનાં પશુઓની પ્રણાલીઓ વિદ્યાર્થી દૂધ ઉત્પાદનમાં વધારો કરવાનો કિદ્દરથ.</li></ul>	મેળવેલ : ગુણ કુલગુણ : -

(3) "ગ્રધાનમંત્રી જનધન યોજના" વિષે માહિતી આપો.

કાબાબ : દેશના ૪૦%, ૩૧થી પુલ વધારે નાગાડીએ કુલિયાચ્યાંપી  
વંચિત નાગાડીને એંડ ર્પડાઉંડ પોલવી નોનાડીએ  
સમાવેશન કરવાના હેતુંથી આ યોજના મલાવવામાં  
આવી છે.

(4) "કુલ સિક્યોરિટી એક્ટ" વિષે માહિતી આપો.

- ખાદ્યાન્ય કુલ્યાના ધોરે ૨૦૧૩ થી : દેશનાં ૬૭.૧, ૨૫  
જાથેના નાગાડીને અસી ખાદ્ય સામુદ્રી માટે  
વૈધાનિક વ્યાધિએ.
- ૨ રૂ. પ્રતિ ડિલો દંડ અને ૩ રૂ. પ્રતિ ડિલો  
ઓષ્ઠા વ્યાપવામાં વ્યાપકી.
- કેલ્ય-રાજ્ય સરકાર મુલાં ૭૫૧૨૫ ના  
ધોરણો કાર્ય.

પ્ર.-3.

આ) દરેક પેટા પ્રક્રિયાનાં 2 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 35 શબ્દોમાં આપવાના રહેશે.

(1) ગુજરાતના બાળકોમાં શિક્ષણ વધે તે માટે રાજ્ય સરકાર એ લીધેલાં પગલાં વિષે જણાવો.

જવાબ : વિશ્વાંગનાં વ્યાપ માણે ક્ષેત્રકાર ઝારા

મેળવેલ :  
ગુણ

10

કુલગુણ : 10

- રાજ્યાધ્રાવેશોભ્યાસ
- આરથીચ, 2009 કાન્ફરન્સનું પાલન કરવામાં હાતું છે.
- મીઠ ડે ખીલ / યોજના વલાવવામાં હાવી છે.
- મદ્દત પાદ્ય પુસ્તકો તથા ગાળવેશ.
- પદ્ધત વિકસનગમાં કંતુરાબા કલ્યાણગમ્યો.
- વિદ્યાર્થીનિયો મારે જ્ઞાયકાર

2

(2) ભારતની "પ્રથમ પંચવર્ષીય યોજના" (Five years' plan) એ ભારતના ભાવિનો પાયો છે" આ વિધાન વિષે જણાવો.

જવાબ : પ્રથમ પંચવર્ષીય યોજના ફૂરા હાર્ફિન્ડ કિઓસ મારે અનેજાં અમલમાં મુદ્દામાં હાવી. (1951 - 1956)

2

- અંતિને માનવિકતા જ્ઞાપવામાં હાવી.
- મિશ્ર અર્થવાવસ્થા ન્યા જાહેર તથા ઘાનથી ઉદ્યોગોનું અસ્તિત્વ.
- અભિનિર્બંધ બનવાનો મંકલ્ય.
- રોજગાર સર્જન મારે જાહેર ઉદ્યોગોની પહેલ,

(3) ભારતના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે જાહેર આરોગ્ય અને સુખાકારી માટેનાં અગત્યનાં કાર્યક્રમો/યોજનાઓ અંગે જણાવો.

- જવાબ :
- "મિશન ઈન્ડ્રૂધનુભ" — બાળ વૈવાન્ય મારે ન પ્રકારના રોકોચી રૂગાન મારે રસીકરણ,
  - "વાચ્છીય સ્વાસ્થ મિશન" — આમિન તથા શહેરી વિકસનગમાં સુલભ અને સર્વત્ર દરે જ્ઞારોગ્ય સેવાઓ મારે.
  - "વાચ્છીય આજુભ મિશન" — ખાંસાં પારંપરિક વૈવાન્ય પદ્ધતિઓ ઝારા સ્વાસ્થનું જરૂર.
  - ટી.બી., એડીસી, મધુમેદ, વગેરે જોવા રોગોનું નિદાન મારે પુરી કાર્યક્રમાં વલાવાય છે.

C  
C.

(4) ભારતના આર્થિક વિકાસમાં રાજ્યોપકૃત વાણિજ્ય બેન્ડોનું યોગદાન જણાવો.

ક્રમાંક : બાળ વ્યવસ્થા દ્વારા આર્થિક માળખાનું ઉત્પાદકતાનું છે,

- ઉચ્ચોગોના વિકાસ અથે ધિરાના વ્યવસ્થા.

- દ્વારાના લોડોને પોતાની ઘણત અભિવાધા માટે મુદ્દુલું વ્યવસ્થા.

- પદ્ધત અને આર્થરીયાડ વિસ્તારોના કિશેસમાં પણ પૂંગડા,

- કૃષિ, નાના અને મંદ્યમ ઉચ્ચોગો, શિગુના વણે માટે,

દ્વારા વ્યવસ્થાથી કિશેસના અપવસ્તુ પ્રદાન કરવા.

- કંઈ લુંગડા વેણો દ્વારા પ્રક્રિયાય છે.

(5) "ભારતના વિકાસમાં રેલ્વેનું ફણો" વિષે નોંધ લખો.

ક્રમાંક : રેલ્વેનું દ્વારા દ્વારા એક્સ્પ્રેસનામાં વાંદવાનો વિશેખ ક્રાંતિ છે.

- ઉચ્ચોગોના વિકાસમાં માલસામાનની હેરેરેથી ક્રાંતિ.

- નાણી ચિડોને રૂડપી, સસ્તુ તથા મુદ્દુલું અધિકારી મનનું વિકલ્પ

- અંતર્યાડ વિસ્તારોને જોડીને દેશની મુખ્ય ધારા માથે જોડવાનું કામ પણ રેલ્વેનું જ કરે છે,

■ દરેક પેટા પ્રશ્નનો 1 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 10-20 શબ્દોમાં આપવાનો રહેશે.

(1) "મેક ઇન ઇન્ડીયા" કાર્યક્રમનો આશય સમજાવો.

ક્રમાંક : મેક ઇન ઇન્ડીયા દ્વારા પારતની વિશ્વમાં મન્દ્યુકુશ્યારીની હુલ્લ તરીકે હુથાપિત હેરવાનો હેતુ દરે અતે ભારતમાં રોજગાર સર્જન ક્રીડે 28નું આર્થિક વિકાસ સાધવાનો આશાય છે.

મેળવેલ :

ગુણ

4

કુલગુણ : 04

2) સને 2015 નાં વર્ષમાં આપવામાં આવેલ જ્ઞાનપીઠ એવોડ મેળવનાર લેખક વિષે જણાવો.

ક્રમાંક : 2015 નાં જ્ઞાનપીઠ એવોડનો વિભેદતા ગુજરાતના જાળીતા સાહિત્યકીય શ્રી રધુબીર જોઘરી છે.

- "મુખ્યમનું" જાળક્યાથી સાહિત્ય સફળની શક્કાણ.

- નાવલક્ષ્યામાં આધુનિકતાના લિભાયતી. મેતવાસ,

- ઉપરવાસ વણે જાળીતી બપલક્ષ્યાઓ.

- "અમૃતા" એમની સૌથી લોકપ્રિય લયમણ્ય

- અમૃતા, અનિદેત, ઉદ્યન મુખ્ય પાકો.

2 /

(3) DMICનું પૂર્ણ નામ જણાવીને તેમાં આવરી લેવાનાર ગુજરાતનાં ક્ષેત્ર વિષે જણાવો.

જવાબ : DMIC → Delhi Mumbai Industrial Corridor.

• ગુજરાતના ઉત્તર પૂર્વ જુદ્ધાયો, સાચાંકાંઠા, અનંતરી  
નથા, અમદાવાદ, ગાંધીનગર, એડા, બાળંડ તથા.  
સમગ્ર દિલ્હીના ગુજરાતનો માવણી લેવાણો.

(4) ગુજરાત રાજ્યમાં આવેલ કંડલા અને હજરા બંદર વિષે જણાવો.

જવાબ :

કંડલા :- ભારતનું પ્રથમ મુખ્ય વ્યાપક બંદર  
ક્ષણની બંદર પાકિસ્તાનમાં છ્યાથી પ્રદેશમાં  
આવી વિકાસ કરવામાં આવેલ.  
ગુજરાતનું સૌથી મોહું બંદર.

હજરા :- બૂજુયાની ક્ષેત્ર ગુજરાતમાં આવેલું બંદર.  
પર્સોલિયમ પેદાશોનાં નિકાસનાં મહેલાનું  
બંદર છે.

દરેક પેટા પ્રક્રિયાનાં 2 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 35 શર્બદોમાં આપવાના રહેશે.

(1) સ્ટેમ સેલ "Stem Cell" નું ચિકિત્સા વિજ્ઞાનમાં મહત્વ શું છે?

જવાબ : એટેગ ક્લીનિચી શારીરિકાનાં વિવિધ અંગોનું નિર્ભાળ કરી શકાય છે. આનાથી શરીરમાં અન્નાંથી અંગોની જરૂરી હૃતિન રીતે વિડસાવેલાં અંગોની પૂછ્યાંથી પણ એરી ફાંડાય. અને વિવિધ વ્યોગાંથીમાં એટેમ સેલ પ્રદૂતિનો ઉપયોગ એરી નિર્ણય કરી શકાય છે.

મેળવેલ :  
ગુજરાત

03

કુલગુણ : 10

(2) "NAVIC" વિશે કું નાંદ લખો.

જવાબ : "નાવિક" એ પારિવહની સંબંધદર્શી નિર્ભાળ IRNSS પ્રણાલીનું વ્યાપકાના વડાપ્રધાન દ્વારા અપાયણું નામ. અંતિગુમાં એ ઉપગ્રાહની વ્યાપક કાળજીએટી - GPS, GLASNESS ની જે સંબંધદર્શી નોવિએશન સેવાઓ,  
- ખાલીએ અને જાહેર સેવાઓ જોવી એ વિમાની વિષ નોવિએરાન, રેલ્વે નોવિએરાન, વાહન વ્યાહ્વારમાં નોવિએશન વર્ગી.

2

(3) નેશનલ બાયોટેકનોલોજી ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી 2015-16 ના ઉદ્દેશો ક્યાં છે?

જવાબ : નેશનલ બાયોટેકનોલોજી ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી 2015-16 દ્વારા  
- ભારતનો બાયોટેકનોલોજીનાં ક્રોટમાં વૈજ્ઞાનિક પ્રોન્ટ અપાવણી.  
- બાયોટેકનોલોજીનાં ઉત્પાદનમાં સહેલ્ય સ્પાન મેળવવું.  
- દૂર્ધિ, સ્વાસ્થ્ય, ધર્યાવરણ જેવા ઝીંકોનું માટ્ટામ  
ઉપયોગ એરી વિકાસ સ્પાદણી.

1

(4) ઉત્તરાખંડનું "દૈવસ્થળી" તાજેતરમાં શા માટે ચર્ચામાં આવેલ હતું?

જવાબ : ઉત્તરાખંડનાં "દૈવસ્થળી" માં લાખ 2013 માં કેદાણમાં  
માં વાદળ ઝારવાળી ધર્યાની જોવી થઈની  
પછી હોવાથી અસ્થીમાં વ્યાવેસ હો.

X

(5) "IAP Health Phone" વિષે જણાવો.

જવાબ : IAP Health Phone ના માધ્યમથી કંવાર્થયાની ફોન્માં ટેલીમેડિસિન્સિયાની વિઠોસ કરવાનો હેતુ છે. તથા વ્યાનાથી જાતિય રોગો તથા કુદુર્ય નિયોજન જોવા કષાકુશય મુદ્દાઓ વિશે ગ્રામીન ફોન્માં પ્રપણ કરવાનો હેતુ છે.

પ્ર.-4. બ) દ્રેક પેટા પ્રશ્નનો 1 ગુણ છે અને દ્રેક ઉત્તર આશરે 10-20 શબ્દોમાં આપવાનો રહેશે.

(1) યૂ યૂ તુ (YouYou Tu) ને કઈ શોધ માટે ઈ.સ. 2015 માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલ હતું?

જવાબ : યૂ યૂ તુ ને મેડિસિનનાં ફોન્માં મલેરીયા બીમારીનાં સર્ટલયમાં સંસોધન મારે ૨૦૧૫ માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલ હતું.

(2) 'UNO' દ્વારા 2016 ને ક્યા વર્ષ તરીકે જાહેર કરેલ છે? આ વર્ષની ઉજવણી અને લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી કોને આપેલ છે?

જવાબ :

X

91

(3) વર્લ્ડ કેન્સર દે 2016-2018 યુંબેશની થીમ (Theme) શું રાખવામાં આવેલ છે?

જવાબ :

X

+) "Imprint India" શું છે?

Imprint India કો<sup>પ્ર</sup> સહાયક માનવ સંસ્કૃતિક  
અને વિજ્ઞાન મંત્રાલય દ્વારા ઉત્ત્ત્વ શિક્ષણમાં  
વિશેષ માધ્યંડાના આધાર વિકાસ કરાની  
હેતુ છે. ઉત્ત્વ શિક્ષણ/ વિશેષ કલાં અન્નવા  
માર્ગ પણોથ અન્યાન્ય તથા બીજો પગાના  
સેવામાં રહાયશે.

પ્ર.-5. અ) દરેક પેટા પ્રક્રિયાનાં 2 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 35 શરીરમાં આપવાના રહેશે.

(1) બે બેટ્સમેન (Batsman) A અને B પાંચ કિકેટ મોચમાં નીચે મુજબ રન કરે છે.

	મેચ ખેલાડી	1	2	3	4	5	
	A	80	10	15	85	10	
	B	35	50	35	45	35	

ઉપરોક્ત બંને ખેલાડીઓ પૈકી ક્યા ખેલાડીએ સરસ અને સાતથ્ય પૂર્ણ રમત રહેલ છે?

જવાબ : A ની ઓંસટ =  $\frac{80 + 10 + 15 + 85 + 10}{5} = \frac{200}{5} = 40$

B ની ઓંસટ =  $\frac{35 + 50 + 35 + 45 + 35}{5} = \frac{200}{5} = 40$

આમ જોઈએ તો વળો ખેલાડીએ ક્રિયા ઓંસટ કૃપે  
અમાન પ્રકારની રમત ક્રમપદમાં આવી છે.

પરંતુ B ખેલાડી ક્રિયા દર્શાવે મોચમાં જીવસ  
અને આત્મધૂર્ણ રમત રહેલ છે.

(2) એક નદીની સરેરાશ ઊંડાઈ (1.5) મીટર છે જ્યારે 5 પ્રવાસીઓની સરેરાશ ઊંચાઈ (2.0)

મીટર છે આ સંભેગમાં બધાજ પ્રવાસીઓ ખુબજ સરળતાથી અને સુરક્ષિત રીતે નદી ચાલીને ઓળંગી શકશે? આ વિધાનની ચર્ચા કરો.

જવાબ : એ વ્યવસ્થામાં બધાજ પ્રવાસીઓ ક્રિયા નાણી વાસીને  
ઓળંગાવી ક્રાક્ય નાણી હેઠ કે કુ પ્રવાસીઓનાં

અનુષ્ઠાનિક ઊંડાઈ પણ એક વ્યક્તિની સરેરાશ ઊંચાઈ

નાણીની ઊંડાઈ અરતા એકોછી હૈથ એને સાંચે

પડું નાણીની ઊંડાઈ પણ વ્યક્તિની રથને 2 ઓંસ

કુરતા ઊંડી હોઈ શકે છે.

08

(3) 3 માણસો 12 દિવસમાં 132 સાડીઓ બનાવે છે તો તો 8 માણસો 6 દિવસમાં કેટલી સાડીઓ બનાવશે?

જવાબ : ધીરો કે 8 માણસ ક્રિયા 6 દિવસમાં 64 સાડીઓ બનાવશે

આવતી સાડીઓની જાંખ્યા કે કે તો

09  $m_1 \times d_1 \times \omega_2 = m_2 \times d_2 \times \omega_1$  (  $m_1, m_2 = 3242$  માણસ  
 $d_1, d_2 = 144$  દિવસ,  $\omega_2, \omega_1 = 213$  સાડીઓ )

$$3 \times 12 \times 213 = 8 \times 6 \times 132$$

$$x = \frac{4}{8 \times 6 \times 132}$$

$$= \frac{4}{576} \text{ કણકિયા.}$$

દરેક પેટા પ્રક્રસ્તનો 1 ગુણ છે અને દરેક ઉત્તર ઓશરે 10-20 શબ્દોમાં આપવાનો રહેશે.

(1) એક વર્તુળની નિયમામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે?

જવાબ : પ્રથમ નિયમ = 10, બાવી નિયમ = 11

$$\text{પ્રથમ ક્ષેત્રફળ} = 10\pi$$

$$\text{નાંનું ક્ષેત્રફળ} = 11\pi$$

$$= 100\pi$$

$$= 121\pi$$

$$\therefore \frac{\text{દૂસરાની વધારો}}{(\text{દ્વારાબદીની})} = \frac{121\pi - 100\pi}{100\pi} = 21\%$$

(2) એક માણસ પાસે કેટલીક મરધીઓ અને કેટલીક ગાયો છે. જો કુલ પ્રાણીઓના માથાની સંખ્યા 65 થતી હોય અને પગની સંખ્યા 210 થતી હોય તો મરધી અને ગાયની સંખ્યા શોધો.


જવાબ :  $x_1$  = ગાયની સંખ્યા;  $x_2$  = મરધીઓની સંખ્યા

$$\therefore x_1 + x_2 = 65 \quad (1) \text{ માને} \quad 4x_1 + 2x_2 = 210 \quad (2)$$

$$x_1 = 65 - x_2 \quad (1)$$

(3) મરધીને (2) નાં મૂકીને (3) કેલવા

$$x_1 = 40 \quad (1) \text{ માને} \quad x_2 = 25 \quad \text{મરધી}$$



ત્રિકોણ AB = 3 સે.મી., BC = 4 cm હોય તો AC નું માપ કેટલું હશે?

જવાબ : પાયથાગોરસનાં નિયમ લિમાની

$$AB^2 + BC^2 = AC^2$$

$$\therefore (3)^2 + (4)^2 = AC^2$$

$$\therefore 9 + 16 = AC^2$$

$$\therefore 25 = AC^2$$

$$\therefore AC = 5 \text{ cm}$$

મેળવેલા :  
ગુણ

06

કુલગુણ : 08

- (4) એક વાહન પ્રથમ 300 કી.મી., 30 કી.મી./કલાકની જડપે ચાલે છે. પછીથી 400 કી.મી. અંતર, 40 કી.મી./કલાકની જડપે ચાલે છે. તો વાહનની સરેરાશ જડપ કેટલી હશે?

જવાબ :  $t_1 = \frac{300}{30} = 10 \text{ min}; t_2 = \frac{400}{40} = 10 \text{ કલાક}$

$\text{સરેરાશ જડપ} = \frac{300+400}{10+10} = \frac{700}{20} = 35 \text{ કી.મી./ઘણાં}$

- (5) સોમથી શનિવારનો સરેરાશ વરસાદ 15 સે.મી. છે. પરંતુ રવિવારે ખુલ જ વરસાદ થવાથી અઠવાડિયાના સરેરાશ 18 સે.મી. થાય છે. તો રવિવારે કેટલો વરસાદ પડેલ હશે?

જવાબ : સોમથી શનિવારનો વરસાદ =  $x$   $\Rightarrow \frac{x}{6} = 15 \Rightarrow x = 90$   
રવિવારને વરસાદ  $y \Rightarrow \frac{y}{6} + 18 = 90 \Rightarrow y = 126 - 90$

રવિવારનો વરસાદ 36 c.m

- (6) એક કર્મચારીનાં પગારમાં પ્રથમ 20% વધારો થાય છે પરંતુ પછીથી 10% ઘટાડવામાં આવે છે તો તેને ખરેખર કેટલો વધારો થયો?

જવાબ : પ્રથમ પગાર  $\rightarrow 100 \text{ રૂ. } 20\% \text{ વધારો \rightarrow } 120 \text{ રૂ.}$   
દૂંબે 10%. થયાં એટલે બાબો પગાર  $\rightarrow 108 \text{ રૂ.}$   
તો જ્યાં કુલ 8%. નો વધારો થયો.

- (7) જો  $x = -2$  હોય તો  $x^3 - x^2 - x + 30$  બરાબર કેટલાં થાય?

જવાબ :  $(-2)^3 - (-2)^2 - (-2) + 30 = -8 - 4 + 2 + 30 = 22$

- (8) "MATHEMATICS" શબ્દમાં સ્વર અને વંઝનની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?

જવાબ : એવી  $\rightarrow A, E, A, I = મંદ્યા 4.$

વંઝન  $\rightarrow M, T, H, M, T, C, S. = મંદ્યા 7.$

એવી સ્વરની મુણોત્તર =	$\frac{11}{3}$
-----------------------	----------------

વંઝન સ્વરની મુણોત્તર =	$\frac{11}{5}$
------------------------	----------------

૧) દરેક પેટા પ્રશ્નનાં ૩ ગુણ છે. અને દરેક ઉત્તર આશરે ૫૦ શબ્દમાં આપવાના રહેશે.

(1) રાજ્યપાલની સત્તાઓ જણાવો.

સાબ : રાજ્યપાલની સત્તાઓ

- વિધાનસભાનાં સત્તા ઘોલવે છે તથા સત્તાવસાન હો છે.
- મુખ્યમંત્રી તથા મંત્રીઓને નિમણું કરાવે છે.
- રાજ્યમાં મુખ્ય વ્યવસ્થાપદ્ધિકારી તથા હાઇકોર્ટનાં માટે વ્યાયાધિકારીને નિમણું કરાવે છે.
- રાજ્ય નાગરિકની નિમણું.

→ રાજ્યપાલને કૃષ્ણને રાજ્યમાં હાચણ - વ્યવસ્થાપદ્ધિકારી કિથીનો છે

૧૫ દિવસે અધીપાલ મોકલે છે

- વિધાનસભાનાં ખરડાને મંજૂરી કરી હાચણ પાસ કરે છે.

(2) "આમુખ" એ બંધારણનો આત્મા છે" વિધાનની ચર્ચા કરો.

સાબ : ◦ બાબાસાહેબ ઝાંપેડેર હૈથ આ વિધાન કહેવામાં માટ્યું હૈ.

- બંધારળામાં આપવામાં આવેલા તમામ છેકોનું આમુખમાં ઉદ્દેશ કરવામાં આવ્યો છે.
- બંધારળાની સમજમાં જીચે કોઈ મુશ્કેલી ઊંઝી ભાય લે એનામુખને ધ્યાનમાં લઈએ રો કરો કરો ઉકેલ કરો છે.
- આમુખ બંધારળાની એક મહિલાપુર્ણ મારી છે.

મજબેલ :

ગુણ

૦૫

કુલગુણ : ૦૯

૧/૨

(3) ભારતના બંધારણ મુજબની પાંચ મુળભૂત ફરજો જણાવો.

સાબ : ◦ પચાંશળાનું રક્તાંશ કરવું.

- સ્વતંત્રતા સંઘર્ષનાં કુલથો તથા વાચ્ચીય પ્રતીકીનું ક્રાંતિ કરવું.

- રાષ્ટ્રીય પરાઈ રૂપી વ્યાપકોની જાહેરાતો કરવી.

૩

- o વૃદ્ધાનિક અધિગમનો વિકાસ કરવો.
- o પોતાના 6-14 વર્ષના બાળનોને શિરૂઆત પ્રાપ્ત થાય અની હાજરી થવી.

પ્ર.-6. બ) દરેક પેટા પ્રશ્નનાં 2 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 35 શબ્દોમાં આપવાના રહેશે.

(1) ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ પાડી શકાય છે?

જવાબ : બંધારણ મુજબ ક્યારે

① ક્રિયમાં શાસન બંધારણ ક્રારા વધ્યાપિત

પદ્ધતિ ક્રારા ન થતું હોય ત્યારે

② ક્યારે વિભાગની સરકાર ક્રારા હેઠળની

મરકારનાં વાહિપણી હુકમોનું પાલન ન થતું

હોય ત્યારે વાચ્ચુપતિ શાસન લાગુ

પાડી ક્રારા હો.

મેળવેલ:  
ગુજરાત

૫૧

કુલગુણા:

૪૮

(1)

(4)

૭૭

(C)

(5)

જવાબ

(2) "વોટ ઓન એકાઉન્ટ" ની ક્યા સંજોગોમાં જરૂર પડે છે?

જવાબ : જથ્થારે સંસ્કારનાં વર્જને ૨ પર વાર્ષી વાલું

હોય અને વર્જને ૨ પસાર થતું ન હોય

અને તે માર્ય પદ્ધતી સરકાર વિભાગના

માર્ય જગ્યાની જરૂર હોય અવા

સંખેરો માં સંસ્કાર ક્રારા લોખાનું હાન

પસાર કરી સરકારને કુદા ક્ષમય નારો

નાભીની વ્યવર્થા કરી ઉદ્ઘાપવામાં આવે હો.

(6)

પ્ર.-6. ક) દરેક પેટા પ્રશ્નનો 1 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 10-20 શબ્દોમાં આપવાનો રહેશે.

(1) "કટ મોશન" વિધાનસભામાં મંજુર થાય ત્યારે શું કાર્યવાહી દાય ધરવામાં આવે છે?

જવાબ : "કટ મોશન" વિધાનસભામાં મંજુર થાય તો

મારકાર ક્રારા વિશ્વાસ પરિવાર વિશ્વાનસભામાં

વિશ્વાસ માટ વાધ્યાપિત કરવો પડે હો.

મેળવેલ  
ગુજરાત

C

કુલગુણા:

૫૮

C

દરેક પેટા પ્રશ્નનો 1 ગુણ છે અને દરેક ઉત્તર આશરે 10-20 શબ્દોમાં આપવાનો રહેશે.

1) સિસ્ટર નિવેદિતા કોણ હતા?

જવાબ : સિસ્ટર નિવેદિતા એ આધરોશ મહિલા હતા જે જીવાભી વિવેકાનંદના સંપર્કમાં વ્યાખ્યા મચી અણાં અનુયાયી બની આપ્ત નિર્દેખયાએ મારે પ્રયત્ન કરતા રહ્યા હાં.

મેળવેલ :  
ગુણ  
જ  
કુલગુણ : 14

2) છેલ્લે "ભારત રણ" પુરસ્કાર કોણ આપવામાં આવેલ છે?

જવાબ : છેલ્લે "ભારત રણ" પુરસ્કાર મુખ્ય મધ્યાનમંત્રી શ્રી અર્જુન પિલારી વાજ્યાપી તથા મરણોપત્ર શ્રી મદન મોહન માલ્ફેસિન આપવામાં આવેલ છે.

3) દેશમાં "અભિલ ભારતીય સેવાઓ" કેટલી છે? કઈ કઈ?

જવાબ : દેશમાં "અભિલ ભારતીય સેવાઓ" ની સંખ્યા ૩ કે ૪, ઇન્ડીયન એડલિનિસ્ટ્રેશન સ્ટાર્ટસ, ઇન્ડીયન પોલીસ સ્ટાર્ટસ તથા ઇન્ડીયન ફોર્ક્સ સ્ટાર્ટસ.

(4) "પોઈન્ટ ઓફ ઓઈર" શું છે?

જવાબ : "પોઈન્ટ ઓફ ઓઈર" નારી સાંસ્કૃતિક કોન્ફરન્સ એ લોકમહિલના મુંદ્ચા પર સાંસ્કૃતિક દ્વારા કોન્ફરન્સ કર્યું હોય તો આતો પ્રક્ષલાવ મુદ્દવામાં વ્યાપ હૈ.

(5) સાતમા પગાર પંચનાં અધ્યક્ષ કોણ છે?

જવાબ :

(6) 26 જાન્યુઆરી 2016 ના દિલ્હી ખાતેનાં સમારંભમાં ક્યા રાષ્ટ્રના વડા મુખ્ય મહેમાન હતા?

જવાબ : 26 જાન્યુઆરી 2016 ના દિલ્હી ખાતેનાં ઠાકરેંગે દિવસનાં મુખ્યમાં હાલેનાં વાદ્યપાત્ર શ્રી ક્રિષ્ણોઇમ મૌલિને મુખ્ય મહેમાન હતા.

(7) "NITI" આયોગનું પૂરું નામ શું છે?

જવાબ : NITI → National Institute for Transforming India

<sup>નિર્માણ કૂદુરુ</sup>  
નોશાલદા ચીની કૂદુરુ હોર યાસફારોમિંગા ઇન્ડિયા.

(8) દાલમાં અમેરિકા દ્વારા ક્યાં દેશ સાથે લગભગ 50 વર્ષ બાદ પુનઃ રાજકીય સંબંધો સ્થાપિત કરેલ છે?

જવાબ : અમેરિકા દ્વારા ક્યાં દેશ સાથે 50 વર્ષ  
પાછ મુન! શ્રીજિય સંબંધો સ્થાપિત  
કરેલ છે.

(9) "UNO" ની સલામતી સમિતિના કાયમી સભાસદો કોણ છે?

જવાબ : અમેરિકા, પ્રિન્સ, ફ્રાન્સ, વિશ્વિય તથા યાઈના

UNO ની સલામતી સમિતિના કાયમી સભાસદો કોણ.

(10) 14 માં નાણાં પંચનાં અધ્યક્ષ કોણ છે?

જવાબ : 14 માં નાણાં પંચનાં અધ્યક્ષ શ્રી વાય.વી. કુંડ્લી  
કે.

(11) એટની જનરલની નિમણુંક કોણ કરે છે?

જવાબ : એટની જનરલની નિમણુંક વાચ્છુપીં દ્વારા  
કુચવામાં આવે છે.

(12) ઉપરાખ્રપતિની ચુંટણીમાં મતદાન કોણ કરી શકે છે?

જવાબ : ઉપરાખ્રપતિની ચુંટણીમાં રાજ્યાધ્યક્ષના તમામ  
મતથો મતદાન કરી શકે છે.

3) JNNURM પોછનાનું આપું નામ શું કે?

જવાબ : Jawaharlal Nehru National Urban Rejuvenation Mission. હાખમાં AMRUT જીવાળ શ્રીડી જીનુરમ એ  
ગૃહીત લેવામાં આવ્યું છે.

14) આદર્શ સ્થિતિમાં વ્યક્તિ દીઠ દરરોજ માટે પાણીની કંદણી ગુરુચિયાત અંદાજવામાં આવે છે?

જવાબ : આદર્શ સ્થિતિમાં વ્યક્તિ દીઠ દરરોજ મારે 4-5 લી.  
પાણીની ગુરુચિયાત અંદાજવામાં આવે છે.